



"Nondiscrimination Notice"

Tanner Medical Center, Inc. (Tanner) doesn't exclude, deny care, treatment or services to, or otherwise discriminate against any person on the basis of race, color, national origin, veteran status, disability (hearing impairment, speech impairment and etc.), Limited English Proficiency (LEP), sex, sexual orientation or age in admission to, participation in, or receipt of the services, whether carried out by Tanner directly or through a contractor or any other entity with which Tanner arranges to carry out its programs and activities.

Tanner provides free aids and services to people with disabilities to communicate effectively with us, such as:

- Qualified sign language interpreters
- Written information in other formats (large print, audio, accessible electronic formats, other formats)

Tanner provides free language services to people whose primary language is not English, such as:

- Qualified interpreters
- Information written in other languages

If you need these services, please contact nursing administration at the clinic or hospital location.

If you believe you've been subjected to discrimination in a Tanner program or activity, there are three ways to file a complaint:

1. By email: bpitts@tanner.org
2. By phone: Call 770-812-8935
3. In writing: Send information about your complaint to:

*Ben Pitts, Director of Risk and Legal Services
705 Dixie Street
Carrollton, Georgia 30117*

Español (Spanish)

ATENCIÓN: si habla español, tiene a su disposición servicios gratuitos de asistencia lingüística.

Français (French)

ATTENTION: Si vous parlez français, des services d'aide linguistique vous sont proposés gratuitement.

Deutsch (German)

ACHTUNG: Wenn Sie Deutsch sprechen, stehen Ihnen kostenlos sprachliche Hilfsdienstleistungen zur Verfügung.

Additional Languages

العربية (Arabic)

لمحظة: إذا كنت تتحدث اذكر اللغة، فإن خدمات المساعدة اللغوية متوفرة لك بالمجان.

አማርኛ (Amharic)

ማስታወሻ: የሚናገሩት ቋንቋ አማርኛ ከሆነ የትርጉም እርዳታ ድርጅቶች፣ በነጻ ሊያገዝዎት ተዘጋጅተዋል። ወደ ሚከተለው

Burmese

Dè dɛ nìà kɛ dyédé gbo: ɔjǔ ké m̩ [Bàsɔ̀ɔ̀-wùdù̀-po-nyò] jǔ ní, nǐí, à wuɖu kà kò dɔ̀ po-poò bɛ̀ìn m̩ gbo kpáa.

繁體中文 (Chinese)

注意：如果您使用繁體中文，您可以免費獲得語言援助服務。

فارسی (Farsi)

فراهم شما بر روی رایگان به صورت زبانی توسط سه یلات کزید، میگویند که فارسی زبان به اگر توجه بایا شد می

ગુજરાતી (Gujarati)

ચુના: જો તમે જરાતી બોલતા હો, તો નિ:લુકુ ભાષા સહાય સેવાઓ તમારા માટ ઉપલબ્ધ છ.

दहिी (Hindi)

ध्यान दें: मदद आप द िंदी बोलते ैं तो आपके दलए मुफ्त में भाषा स ायता सेवारें उपलब्ध ैं।

Igbo asusu (Ibo)

Ntị: Ọ bụrụ na asụ Ibo, asụsụ aka ọasụ n'efu, defu, aka.

日本語 (Japanese)

注意事項：日本語を話される場合、無料の言語支援をご利用いただけます。

한국어 (Korean)

주의: 한국어를 사용하시는 경우, 언어 지원 서비스를 무료로 이용하실 수 있습니다.

Kreyòl Ayisyen (French Creole)

ATANSYON: Si w pale Kreyòl Ayisyen, gen sèvis èd pou lang ki disponib gratis pou ou

नेपाली (Nepali)

ध्यान दिनुहोस्: तपाईंले नेपाली बोल्नुहुन्छ भने तपाईंको दनदतत भाषा सहायता सेवाहरू दनि:शुल्क रूपमा उपलब्ध छ

Português (Portuguese)

ATENÇÃO: Se fala português, encontram-se disponíveis serviços linguísticos, grátis

Русский (Russian)

ВНИМАНИЕ: Если вы говорите на русском языке, то вам доступны бесплатные услуги перевода.

Tagalog (Tagalog - Filipino)

PAUNAWA: Kung nagsasalita ka ng Tagalog, maaari kang gumamit ng mga serbisyo ng tulong sa wika nang walang bayad.

اُردُو (Urdu)

دارخ بر: گ را آپ اردو ہ ہیں ے تلو، ت و آپ ک و ن باز مددکی خدمات کی میں م فت ب س ت یاد ہ ہیں -

Vietnamese Tiếng Việt (Vietnamese)

CHÚ Ý: Nếu bạn nói Tiếng Việt, có các dịch vụ hỗ trợ ngôn ngữ miễn phí dành cho bạn.

èdè Yorùbá (Yoruba)

AKIYESI: Bi o ba nsọ èdè Yorùbú ọfé ni iranlọwọ lori èdè wa fun yin o.